

Psa

Chapter 37

Gujarati Interlinear

Reference: American Standard Version

1	אֱלֹהִים אל- બલવા-નહીં H0408	תִּתְחַר ગુસ્સા-કર H2734	בְּמַרְעִים ખરાબ-કરનારાઓ-પર H0408	אֶל- ઈર્ષ્યા-નહીં H0408	תִּקְנָא કર H7065	בְּעָשִׂי અન્યાય-કરનારાઓ અન્યાયનો	עֲלֶיךָ અન્યાયનો
2	כִּי કેમ-કે	בְּחַצִּיר ઘાસ-જેમ	מִהַרְהָ જલદી	יִמְלֹךְ તેઓ-કરમાશે	וּבְיָרֵךְ અને-લીલી-વનસ્પતિ	יְשֹׁא લીલા-ઘાસની	יְבֹלֵן કરમાશે
3	בְּטַח ભરોસો-રાખો	בְּיְהוָה યહોવાહમાં	וְעֵשָׂה- અને-કરો	טוֹב ભલાઈ	שָׁכַן- વસો	וּרְעָה અને-ચરાવો	אֶמְוָנָה વિશ્વાસુપાત્રતાને
4	וְהִתְעַנְנָה અને-આનંદ-માણો	עַל- યહોવાહમાં	יְהוָה યહોવાહમાં	וַיִּתֵּן- અને-તે-આપશે	לְךָ તને	מִשְׁאֲלֹת તારા-હૃદયની	לְבָבְךָ ઇચ્છાઓ
5	גִּבּוֹר સૌપો	עַל- યહોવાહને	יְהוָה યહોવાહને	דְּרָכָי તમારો-માર્ગ	וּבְטַח અને-ભરોસો-રાખો	עָלְיוֹ તેમના-પર	וְהוּא અને-તે
6	וְהוֹצִיא અને-તે-પ્રગટ-કરશે	כְּאוֹר પ્રકાશ-જેમ	צַדִּיק તમારો-ન્યાય	וּמְשַׁפְּטֵי અને-તમારો-ન્યાય	כְּצַדִּיקִים મધ્યાહ્ન-જેમ		
7	וְהוֹדוּ શાંત-રહો	לְיְהוָה યહોવાહમાં	וְהִתְחַלְּלוּ અને-ધીરજથી-રાહ-જુઓ	לוֹ તેમની	אֶל- બલવા-નહીં	תִּתְחַר ગુસ્સા-કર	בְּמִצְלִיחַ સફળ-થતા
		עֲשֵׂה જે-કરે-છે	מִזְמוֹת કુચુક્તિઓ				
8	הָרָף છોડો	מֵאָף ક્રોધને	וְעֵזָב અને-ત્યાગો	חַמָּה ગુસ્સાને	אֶל- બલવા-નહીં	תִּתְחַר ગુસ્સા-કર	אֶל- કેવળ
9	כִּי- કેમ-કે	מַרְעִים ખરાબ-કરનારા	יִבְרָתוּן કાપી-નાખવાશે	וְקָנִי પરંતુ-યહોવાહની-રાહ-જોનારા	יְהוָה યહોવાહની	תְּהַמָּה તેઓ	יִירָשׁוּ- દેશનો-વારસો
10	וְעוֹד અને-થોડા	מֵעַט સમયમાં	וְאִין અને-નહીં-હશે	רָשָׁע દુષ્ટ	וְהִתְבֹּנְנָה અને-તું-જોશો	עַל- તેના	וְאִינְנוּ અને-તે-નહીં-હશે
11	וְעַנְיִים પરંતુ-નમ્ર-લોકો	יִירָשׁוּ- દેશનો-વારસો	אֶרְצָי પામશે	וְהִתְעַנְנָה અને-આનંદ-માણશે	עַל- પુષ્ટ	רַב શાંતિમાં	שְׁלֹמִים શાંતિમાં
12	זִמְם યોજે-છે	רָשָׁע દુષ્ટ	לְצַדִּיק ન્યાયી-વિરુદ્ધ	וְחָרַק અને-કચકચાવે-છે	עָלְיוֹ તેની-વિરુદ્ધ	שְׁנֵיוֹ તેના-દાંત	

25	אָרְרַעַן કે-તેનું-સંતાન H2233	נֶעֱזָב ત્યજી-દેવાયેલો	צָרִיק -ચાચીને	רְאִיתִי જોયું	וְלֹא- અને-મેં-કયારેય-નહીં	רָקַנְתִּי વૃદ્ધ-પણ-થયો-છું	גַּם- હવે	הָיִיתִי હતી	וְנָעַר હું-જીવાન	
								מִבְּקֶשׁ- રોટી-શોધતું	לָחֶם: રોટી	
								H3899	H1245	
26			לְבָרְכָה: આશીર્વાદ-માટે	וְנָעֲרָה અને-તેનું-સંતાન	וּמְלוֹחָ અને-ઉધાર-આપે-છે	חֹנֵן દયાળુ-છે	הַיּוֹם દિવસ	כָּל- બધો		
			H1293	H2233			H3117	H3605		
27				לְעוֹלָם: સદા-માટે	וַיִּשְׁכַּן અને-વસો	טוֹב ભલાઈ	וַעֲשֶׂה- અને-કરો	מֵרַע પરાભીથી	סוּר- દૂર-થા	
				H5769	H7931				H5493	
28	נִשְׁמְרוּ સંરક્ષિત-છે	לְעוֹלָם સદા-માટે	קִסְדֵי પોતાના-ભક્તોને	אֶת- —	יַעֲזֹב છોડતો	וְלֹא- અને-ત્યાગતો-નથી	מִשְׁפָּט -ચાયને	אֶהָב પ્રેમ-કરે-છે	וְהוֹדָה ચહોવાહ	כִּי- કેમ-કે
	H8104	H5769	H2623	H0853		H3808	H4941	H0157	H3068	
							נִכְרָת: કાપી-નાખવાશે	רְשָׁעִים દુષ્ટોની	וְזָרַע પરંતુ-વંશ	
							H3772	H7563	H2233	
29			עֲלֵיָהָ: તેના-પર	לְעַד સદા-માટે	וַיִּשְׁכְּנוּ અને-વસશે	אֶרֶץ પામશે	יִירָשׁוּ- દેશનો-વારસો-પામશે	צָרִיקִים -ચાચીઓ		
				H5703	H7931	H0776	H3423	H6662		
30			מִשְׁפָּט: -ચાયનું	הַדְּבָר બોલે-છે	וְלִשְׁוֹנוֹ અને-તેની-જીભ	חֲכָמָה જ્ઞાન	וְהִנְהָה બોલે-છે	צָרִיק -ચાચીનું	פִּי- મુખ	
			H4941	H1696	H3956	H2451	H1897	H6662	H6310	
31			אֲשֶׁרֵינוּ: તેના-પગલાં	תְּמַעַד લપસશે	לֹא નહીં	בְּלִבּוֹ તેના-હૃદયમાં-છે	אֶלְהֵינוּ તેના-ઈશ્વરનો	תּוֹרַת ઈશ્વરનું-નિયમ		
				H4571	H3808		H0430	H8451		
32					לְהַמְרִיתוֹ: તેને-મારવા	וּמִבְּקֶשׁ અને-શોધે-છે	לְצָרִיק -ચાચીને	רָשָׁע દુષ્ટ	צוֹפָה તાકે-છે	
					H4191	H1245	H6662	H7563	H6822	
33			בְּהַשְׁפָּטוֹ: જ્યારે-તેનો-ન્યાય-થાય	יִרְשִׁיעֵנוּ તેને-દીધિત-ઠરવશે	וְלֹא અને-નહીં	בִּירוֹ તેના-હાથમાં	יַעֲזֹבֵנוּ છોડશે-તેને	לֹא- તેને-નહીં	יְהוֹדָה ચહોવાહ	
			H8199	H7561	H3808	H3027		H3808	H3068	
34	אֶרֶץ દેશ	לְרִשְׁתָּהּ દેશનો-વારસો-પામવા	וַיִּרְוּמָהָ અને-તે-તને-ઉંચો-કરશે	הַרְבּוֹ તેમનો-માર્ગ	וַיִּשְׁמָר અને-જાળવો	וְהוֹדָה ચહોવાહની	אֶל- ચહોવાહની	קִנְיָה રાહ-જીઓ		
	H0776	H3423		H1870	H8104	H3068	H0413			
						תְּרָאָה: તું-જોશો	רְשָׁעִים દુષ્ટોના	בְּהַכְרִיתָ દુષ્ટોના-કાપી-મૂકવામાં		
						H7200	H7563	H3772		
35			רַעְיוֹן: લીલું	כְּאִזְרָח લીલા-વૃક્ષ-જેમ	וּמִתְעַרְהָ અને-ફેલાયેલો	עָרִיץ અત્યાચારી	רָשָׁע દુષ્ટને	רְאִיתִי મેં-જોયો		
				H0249	H6168	H6184	H7563	H7200		
36			נִמְצָא: મળ્યો	וְלֹא અને-નહીં	וְאִבְכַּשְׁתָּהּ અને-મેં-તેને-શોધ્યો	אֵינְנִי તે-નહોતો	וְהִנְהָה અને-જીઓ	וַיַּעֲבֹר પરંતુ-તે-પસાર-થયો		
			H4672	H3808	H1245	H0369	H2009			

								37
	שָׁלוֹם:	לְאִישׁ	אֲחֵרִית	כִּי־	יִשָּׂר	וּרְאָה	תָּם	שָׁמֵר־
	शांतिनुं	ते-माणसने	भविष्य-छे	केम-के	सीधाने	अने-शुओ	निर्दोषने	ध्यान-आपो
	H7965	H0376	H0319		H3477	H7200	H8535	H8104
		נִכְרָתָהּ:	רְשָׁעִים	אֲחֵרִית	יַחַדְו	נְשָׁמְדוּ	וּפְשָׁעִים	38
		डापी-नाभवशे	दुष्टीनुं	भविष्य	साथे-मलीने	नाश-पामशे	परेतु-अपराधीओ	
		H3772	H7563	H0319		H8045	H6586	
		צָרָה:	בְּעֵת	מְעוֹזָם	מִיְהוָה	צְדִיקִים	וּתְשׁוּעָת	39
		કચના	કચના-સમયમાં	તેમનો-ગઢ-છે	યહોવાહથી-છે	ન્યાયીઓનો	અને-ઉદ્ધાર	
			H6256	H4581	H3068	H6662	H8668	
	וַיִּוְשְׁעֵם	מְרַשָּׁעִים	יִפְלְטֵם	וַיִּפְלְטֵם	יְהוָה	וַיַּעֲזְרֵם		40
	अने-बचावे-छे-तेमने	दुष्टीथी	छोडावे-छे-तेमने	अने-तेमने-छोडावे-छे	यहोवाह	अने-यहोवाह-तेमने-सहाय-करे-छे		
	H3467	H7563	H6403	H6403	H3068	H5826		
					בּוֹ:	קָסוּ	כִּי־	
					तेमनामां	आश्रय-लीधो	केम-के	
						H2620		